

LEGEND

20 MM Ø P.V.C RIGID PIPE IN FLOOR.

EARTH PIT

TELEPHONE POINT

2 NOS OF 5 A 5 PIN SOCKET + 1 NO OF 15 A SOCKET WITH ONE NO 15 A SP SWITCH + COMPUTER OUTLET.

LEGEND

2' X 2' PLIGHT FIXTURE WIPRO MAKE


1' X 1' PLIGHT FIXTURE

8" DIA ROUND PL.FIXTURE

6" DIA ROUND PL.FIXTURE

3" DIA SPOT LIGHT (HALOGEN)

ARCHITECT:	ABHIKALP DESIGNS,VADDADARA.
CLIENT:	CHEMTROLS ENGG LTD, 40IGLACIER COMPLEX, JETALPUR ROAD,BARDOLA.
DRAWING (AS BUILT)	UNDER GROUND PVC PIPE LAYOUT FOR POWER,COMPUTER AND TELEPHONE NETWORK.
ELECTRICAL CONTRACTOR:	NK ASSOCIATES,BARDOLA, PH : 0265 - 2391870
DATE:	27/12/06
DRG NO :	01



MGVCL

મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ

૩૪૭, આશિષ ૩૩૬/૩ ૧૨૬૨ વિધાન ભવન, રેલવે, ૩૮૬૩૩-૩૮૦૦૦૭

e-mail : info@mgvcl.co.in, mgvcl@mgvcl.co.in, mgvcl@mgvcl.co.in, DTR : 1405072501500002977, GST IN : 24AAACN740N171

(વીજ વપરાશ બીજ)

CHEMETROLS ENG LTD
401 402 GLACIERS COMP
OPP ANUPAMNKA JETELPUR
VILLAGE VADODARA (M CORP+00)
TALUKA VADODARA
DISTRICT VADODARA

0051 JETALPUR
JTLAN1

15105019342

51-MOS-245052

બીજ નંબર

કોડ

2208

MPGP

BRD ALKAPURI


98X81X728

APR, MAY, 24

4/05/20155

બીજ નંબર

15105019342



MGVCL

BRD ALKAPURI
Consumer No: 15105019342
CHEMETROLS ENG LTD
401 402 GLACIERS COMP
OPP ANUPAMNKA JETELPUR

BILL NO: 4/2208
Period : APR, MAY, 24
Mtr No : 1-MOS-245052
Route : 4/05/20155

Tarif : MPGP

Average: 120

SD : 121340

Load : 121.00

Billing Date : 02/06/2024
Current Reading : 7251
Previous Reading : 69907174
Reading Difference : 777
Reactive Cur Reading : 0
Reactive Prv Reading : 0
Reactive Consumption : 0
Meter Status :
Actus Demand : 0.00
MF : 1.00
Adjustment Amount : -1451.08
Prov. Bill Amount : 0.0

Fixed Charge : 2870.00
Energy Charge : 3853.05
BLANK Charge : 0.00
Fuel Charge : 2274.45
Reactive Charge : 0.00
Electric Duty : 1709.50
Water Rent : 0.00
DPC : 41.08
Fuse Mtr Charge : 0.00
Total Amount : 10478.05
Prov. Amount : 0.00
Bill Amount : 10478.05
Arrears Date : 24/05/2024
Arrears : -1451.08

Net Amount : 9026.98
GOVT RELIEF : 0.00
Payable Amount : 9026.98
Due Date : 12/06/2024

Ver 4.0 MtrNo: JVR10621
02/06/2024 17:49:21



Scan QR Code for Online Payment

MGVCL

બીજ નંબર

કોડ

બીજ નંબર

કોડ

બીજ નંબર

કોડ

15105019342

MAY-2024

બીજ નંબર

કોડ

બીજ નંબર

કોડ

15105019342

AmB... is a... of charges for the
Energy consumed during the billing period and total
amount payable by the consumer shall not be
considered as a proof of ownership of property



વડોદરા મહાનગરપાલિકા

મિલકતનો ઓળખ નંબર
06-00001-021

સેન્સસ નંબર

06-08-271-171-098-021

બીલ નંબર

208000281

બીલની મુદત

2022-23

ઈલે.વોડ

8

કર/ચાર્જ ભરવાને પ્રથમ પાત્ર ધરાવેલું નામ : SHRI CHEMTROLS INDUSTRIES LIMITED

સરનામું : OFFICE NO-401 "GLACIER" NR.KASHI VISHWESHAR MAHADEV JETALPUR ROAD VADODARA

ભોગવટો કરનારનું નામ : O/O

વિગત	રકમ (અ)	ક્ષેત્રકળ આધારીત પદ્ધતિ		કુલ રકમ (અ+બ+ક)
		વિગત	પાછલી બાકી ચાલુ માંગણું (ક)	
સામાન્ય કર/મિલકત વેરા	0	સામાન્ય કર	0	21669
નોટીસ ફી	0	નોટીસ ફી	0	109
વોરંટ ફી/જાહેરાત ખર્ચ	0	વોરંટ ફી/જાહેરાત ખર્ચ	0	0
વ્યાજ	0	વ્યાજ (સામાન્ય કર)	0	748
શિક્ષણ ઉપકર	0	શિક્ષણ ઉપકર (સરચાર્જ)	0	6501
શિક્ષણ ઉપકર દંડ	0	શિક્ષણ ઉપકર (સરચાર્જ) દંડ	0	1625
કાયર ટેક્સ	0	કાયર ટેક્સ	0	0
કાયર ટેક્સ નોટીસ ફી	0	કાયર ટેક્સ નોટીસ ફી	0	0
પાણી કર/પાણી વેરા	0	પાણી ચાર્જ	0	0
		પાણી ચાર્જનું વ્યાજ	0	0
		પાણી કર	0	5418
		પાણી કર નોટીસ ફી	0	27
		પાણી કરનું વ્યાજ	0	187
કન્ઝર્વેન્સી ટેક્સ/લાઇટ વેરા	0	કન્ઝર્વેન્સી અને સુઅરેઝ ટેક્સ	0	7584
		કન્ઝર્વેન્સી અને સુઅરેઝ ટેક્સ નોટીસ ફી	0	38
		કન્ઝર્વેન્સી અને સુઅરેઝ ટેક્સનું વ્યાજ	0	262
સ્પે.સેનેટરી સેસ/સફાઇ વેરા	0	સફાઇ ચાર્જ	0	2500
કુલ	0	કુલ	0	46668

રકમ શબ્દોમાં : Rupees Forty Six Thousand Six Hundred Sixty Eight Only

Full Payment

Bank Transaction ID : YCBI1782368497

CARD of BILL DESK(NET-BANKING)

પાવતી નંબર : 80010090

તારીખ : 13-Mar-2023


નાણા લેનારની સહી

Note : This is computer generated receipt, hence signature is not necessary.
Subject to actual payment received by the Vadodra Municipal Corporation.

4-30R-000

THE KALUPUR COMMERCIAL CO-OP BANK LTD.
VADODARA
GUD/SOS/AUTH/AV/48/2006
STAMP DUTY GUJARAT
INDIA
VAD/364

Serial No. 004-22 Date 13/7/2006
Name Chemtrolls Engineering Ltd
&
Address 910 Tulsiani Complex 212, Nariman Point, Mumbai
Value Rs. 30,00,000/-
(Words) Ninety thousand only
The Kalupur Comm. Co-op. Bank Ltd.
Licence No. GUD/SOS/AUTH/AV/48/2006
Sign. *[Signature]*



: SALE DEED:

This Sale deed is executed on Date : 20 Month July and the Year 2006

Between

Chemtrolls Engineering Ltd., a Company incorporate under Companies Act, 1956 having office at 910, Tulsiani Chambers, 212, Nariman Point, Mumbai-400 021 bearing PAN No : AAACC2870R, Represented by and on behalf of Board of Directors, Mr. K. Nandakumar, Designation : Managing Director, Aged 57, Occupation Business, Address at : Amar Hill, Saki Vihar Road, Powai, Mumbai - 400 072 (Herein after referred to as the parties of the First Part, which expression shall mean and include all their heirs, executors, successors, administrators etc.)

AND

(1) Shri Shashikant Rasiklal Patel, Age : Adult, Occupation : Business, bearing PAN No : AFJPP 1875 N & (2) Shri Satishbhai Rasiklal Patel, Age : Adult, Occupation : Business, bearing PAN No : AFJPP1878 B, Both Residing at 16, Indrapuri Society, Harni Road, Vadodara, the Owners (Herein after referred to as the parties of the Second Part, which expression shall mean and include all their heirs, executors, administrators, etc.)

AND

(3) M/s. Shiv Associates, a partnership firm registered under the Partnership Act bearing PAN No : AANFS5170 R through its Partners :

1. Shri. Shashikant Rasiklal Patel, Age : Adult, Occupation : Business
2. Shri. Satishbhai Rasiklal Patel, Age : Adult, Occupation : Business

Both Residing at : 16, Indrapuri Society, Harni Road, Vadodara the Developers, (hereinafter referred to as the parties of the 3rd part, which expression shall mean and include all their heirs, executors, administrators, etc.)

WHEREAS the Property bearing RS No : 104 of Village Jetalpur was earlier of the ownership of Fulabhai Jivabhai Gohil and the said property was declared of Freehold land under the Urban Land Ceiling Act vide Order of the Competent Authority Bearing No : ULS / D No : 882 dtd : 30 / 12 / 1993 . The said property was divided into different plots and Baroda Municipal Corporation had sanctioned a Lay-out Plan for the said property along with the Construction Vide No : L - 88 / 94-95 , dated 19 / 09 / 1994 . On the basis of the said sanctioned plans, the collector - Baroda had granted the permission for Non- Agricultural use vide his Order no : Land / D / Vashi / 2230 to 2236 / 97 dtd : 15 / 09 / 1997 . Out of the said plots of the Anupam Co Operative Housing Society formed by the owners of the various plots, Sub- Plot Numbers : B-1 and B-2 were allotted to the parties of the Second Part in the Year 1998.

BRA - 3
ATA

WHEREAS the parties of the Second part have obtained necessary permission for the construction from Vadodara Municipal Corporation and on the basis of the Sanctioned Lay-out Plan, vide its Construction Permission No : Ward / 6 / 839 / 98-99 dtd : 05 / 02 / 1999 permitting to use (1 : 6) F.S.I. the parties of the Second Part and Third Part have made the construction in the name of Glacier Commercial Complex.

6/38
2006

WHEREAS the parties of the Second part are well and sufficiently entitled to and are the owners of Shops & Office premises including Office no : 401 & adjoining east terrace of Glacier Commercial Complex constructed on sub Plot Nos : B-1 & B-2 of Plot B of Anupam Co.Op. Housing Society Ltd., situated on the land bearing R.S.L No : 104 (Part) and City Survey No : 1062 / 1063 of Moje Jetalpur Regn. District & Sub-District Vadodara. The said Office premise No : 401 having its carpet area of 122.00 Sq. Mtrs., Common utility area of 30. 50 Sq. Mtrs and with an Open Terrace of 191.00 Sq. Mtrs of carpet situated on the FOURTH Floor of the said Complex and having right in undivided common land area of 76 Sq. Ml of the detailed description of the said premises is described herein below and now referred to as the said premises.

WHEREAS the parties of the Second Part have formed a Partnership firm in the name of Shiv Associates , i.e. the parties of the Third Part , for the purpose of development of the said property.

WHEREAS the parties of the First Part have shown their readiness and willingness to purchase the said premises and the parties of the Second Part and Third Part have agreed to sell the said premises to the parties of the First Part on the terms and the conditions hereinafter mentioned.

That the sale price of the said premises is agreed upon by and between the parties and that the parties of the First Part have paid the said amount of Rs. 14,85,480.00 (Rupees Fourteen Lacs Eighty Five Thousand Four Hundred Eighty Only -) against the said total consideration as under :

Sr. No.	Name	Cheque No.	Bank	Amount INR
1	Shiv Associates	439641	CBI - Paliwal	5,00,000.00
2	Shiv Associates	520307	HDFC Bank Ltd	5,52,280.00
3	Shashikant R. Patel	520306	HDFC Bank Ltd	2,16,600.00
4	Satishbhai R. Patel	520343	HDFC Bank Ltd	2,16,600.00
				14,85,480.00

The Parties of the Second Part and Third Part acknowledged the receipt of the said Consideration of Rs.14,85,480.00 (Rupees Fourteen Lacs Eighty Five Thousand Four Hundred Eighty Only -) as the total Sale Price and in consideration thereof the parties of Second and Third Part hereby sale the said premises along with the possession to the party of First Part.

AND WHEREAS the Parties of Second Part and Third Part hereby convey to the purchaser the said premises along with all the rights and ways attach there to including common amenities attached to the Building Such as Lifts , Toilets , Parking , Common Passage , Staircase , etc. belonging to the said property as a part and parcel thereof appurtenant thereto by this Deed.

The Parties of Second Part and Third Part declare that this deed conveys to the purchaser i.e. parties of the first part all the assets, rights, title, interest of the said parties of the Second and Third part in or upon the said premises and further the said parties of Second and Third part have handed over peaceful and vacant possession of the said premises, which the purchaser i.e. party of First Part has accepted and taken possession thereof.

The said premises as described in the schedule hereunder is of the absolute ownership of the party of Second Part and Third Part and nobody else is having the right of any nature in existence as on today and the parties of the Second Part and Third Part hereby indemnify the purchaser i.e. parties of the First Part of any such right if at all existing in relation to the said premises.

Now on the basis of the Sale Deed the Purchaser i.e. the parties of the First Part becomes the owner of the said premises and the parties of the Second Part and Third Part hereby undertake to co-operate with the purchase in transferring the said property in their names (Parties of the First Part) at all places including records of Society, Corporation, City Survey Office and other local and Government Offices.

The Parties of the Second part and Third part declare that all the taxes, CESS, electricity charges and other charges have already been paid as on the day of possession and the purchaser will have to pay all such future taxes, CESS, electricity charges etc. in respect of the said premises.

The parties of the First Part shall pay necessary Building Maintenance charges to the society that may be formed by the owners of the said Building and keep the Building premises in good maintainable condition.


That the parties of the Third part have their full and final right for common terrace (other than the terrace areas of 191 m² conveyed under the agreement on the fourth floor), Parking, Out Skirts of the building; as also in future if Vadodara Municipal Corporation permits further Construction then they are at will to carry out the Construction and sale the premises to any body or keep it within them without any interruption by any of the occupant or Glacier Owner's Maintenance Association and give full cooperation in this regards for the use of water, water pumps electrical services needed for the construction should be given. All these conditions as applicable to the purchaser or his tenant there off.

That the purchaser or his tenant is restricted from keeping or preserving any kind of flammable substances within his owned premises or from keeping any obstructions, debris, furniture in the Common Passages, Staircase, Basement, Terraces, or in the Outskirts of the Building.

That the purchasers have become the owners of the said premises and the exclusive possession is handed over to the purchasers. Now, the Purchaser is entitled to the said premises as the Owners and can deal with the said property as they think fit.

That the parties of Second part and Third part hereby declare that the title of the said premises is clear, marketable and without any encumbrances and further undertake to remove all the defects whatsoever, if at all, that may in future arise in respect of the said property.

That all the expenses of this Sale Deed, including stamp duty and registration charges, service tax as applicable etc., shall have to be borne by the purchaser.



: DESCRIPTION OF THE PROPERTY :

Office Permits bearing No : 401 , and its adjoining open terrace of Glacier Complex constructed on Sub Plot nos : B - 1 & B - 2 of Plot B Anupam Co-operative Housing Society Ltd, situated on the Land bearing R.S.No : 104 (Part) and City Survey No : 1062 / 1063 of Moje Jetalpur , Regn. District and Sub-District : Vadodara . The said office premises No : 401 is having its built-up area 122.00 Sq.Mtrs. and adjoining Terrace of 191.00 Sq. Mtrs. Situated on the Fourth Floor of the said Complex and having right in undivided common land area of 76.00 Sq. Mtrs. And bounded as :

- EAST : Building Marginal Space
- WEST : Office no : 404
- SOUTH : Stair Passage and Open terrace of Office no : 402
- NORTH : Building Marginal Space

In witness where of this Sale Deed is executed today the 24 day of the July Month, of the 2006 Year at Vadodara

Parties of First Part :



Parties of Second Part :

Witnesses :

1: [Signature]
(Sashikant Rasiklal Patel)

1: [Signature]


2: [Signature]
(Satishbhai Rasiklal Patel)

2: [Signature]
Poolesh Gandhi

Parties of Third Part :
Shiv Associates represented through its partner

1: [Signature]
(Sashikant Rasiklal Patel)


2: [Signature]
(Satishbhai Rasiklal Patel)




SCHEDULE AS PER REGISTRATION ACT : 1908 , SECTION : 32



A handwritten signature in black ink, appearing to be 'M. M. M.' or similar, written over a horizontal line.



A handwritten signature in black ink, appearing to be 'B. B. B.' or similar, written over a horizontal line.




A handwritten signature in black ink, appearing to be 'G. G. G.' or similar, written over a horizontal line.



અનુક્રમ નંબર ૬૧૩૮
સને ૨૦૦૬ ના જુલાઈ માસની
૨૭ થી તારીખે ૧૧ થી ૧૨
વાગ્ધાની વચ્ચે વડોદરા-૩ (અકોટા) સબ
રજીસ્ટ્રારની કચેરીમાં રજુ કર્યા.



(આઈ.એમ.વસાવા)
સબ રજીસ્ટ્રાર
વડોદરા-૩ (અકોટા)



પર્કોચ નંબર :- ૩૯૩૯૬૬
કી પર્કોચી છે તે રૂ. પૈસા.
નોંધવાની કી :- ૨૨૩૬૫
ગોટો કી પાનના (૮) :- ૮૦
ટપાલ :- ૦
એકેદરે કુલ :- ૨૨૪૪૫

(અંકે રૂપિયા બાવીસ હજાર ચારસો પિસતાલીસ પુરા:-)

(આઈ.એમ.વસાવા)
સબ રજીસ્ટ્રાર
વડોદરા-૩ (અકોટા)

વનનુ. પસકારનું નામ અને સરનામું ૭૫૨ ગોટોઆક ડા.કા.અ.ની છાપ સહી

આપનાર
૧. શ્રીકાંત રસિકભાઈ પટેલ (વેપાર)
હરણી રોડ, વડોદરા.

૫૫



(આઈ.એમ.વસાવા)

પાન નં. AFJPP1875N

સતીષભાઈ રસિકભાઈ પટેલ (વેપાર)
હરણી રોડ, વડોદરા.

૪૮



(આઈ.એમ.વસાવા)

પાન નં. AFJPP1878B


સંમતી આપનાર
૩. મે. શીવ એસોસીએટસના ભાગીદાર
શ્રીકાંતભાઈ રસિકભાઈ પટેલ (વેપાર)
હરણી રોડ, વડોદરા.

૪૮



(આઈ.એમ.વસાવા)


પાન નં. AANFS5170R



દસ્તાવેજ લખી આપનાર
આ દસ્તાવેજ લખી
આપ્યાનું કબુલ કરે છે.

૧. બશોકુમાર એસ. પટેલ (વેપાર)
કડવાશીરી, વડોદરા.

જેમને સબ-રજિસ્ટ્રાર ઓળખે છે, તેઓ
કહે છે કે સદરહું લખી આપનારને તેઓ જાતે
ઓળખે છે. અને તેમની ઓળખાણ આપે છે.



તારીખ ૨૦ માઠે જુલાઈ - ૨૦૦૬



(આઈ.એમ.વસાવા)
સબ રજિસ્ટ્રાર
વડોદરા-૩ (અકોટા)

બજાર કિંમત નક્કી કરવા અંગેનું
ફોર્મ નં. ૧ રજુ થયેલ છે.
તા. ૨૦/૦૭/૨૦૦૬



(આઈ.એમ.વસાવા)

સબ રજિસ્ટ્રાર
વડોદરા-૩ (અકોટા)

ઇન્કમેટેક્સ રૂલ્સ ૧૯૬૨ની જોગવાઈ મુજબ
(૧) પાન નં./ઈ.જ.ર નંબર
દર્શાવેલ છે. જેની ખરાઈ કરવામાં આવેલ છે.

આપનાર નંબર. AFTPP 1875 M. AA NFS 570 R

લેનાર નંબર. RAAC 2870 R.

સંમતી આપનાર નંબર. —

તારીખ: ૨૦/૦૭/૨૦૦૬

(આઈ.એમ.વસાવા)

સબ રજિસ્ટ્રાર
વડોદરા-૩ (અકોટા)

અર્નાકમ(શિકા નંબર નં ૨

સામ-રજીસ્ટ્રાર કચેરી

એસ આર સી - Akola

ગામન નામ : જતલપુર

દસ્તાવેજની પ્રકાર અને અલેજ (લપકા પટાના કિસ્સામાં આકાર પટે આપનાર અથવા પટે રાખનાર આપે છે તે જણાવવું)	સર્વે નંબર પેટા વિભાગ નંબર અને ઘર નંબર (જો કંઈ પણ હોય તો) આકાર અથવા જુદી આપવામાં આવે ત્યારે તે	દસ્તાવેજ કરી આપનાર પક્ષકારનું નામ અથવા દિવાની કોર્ટના કુકમનામાં અથવા આદેશના સંબંધમાં પ્રતિવાદીનું નામ	દસ્તાવેજ કરી તેનાર પક્ષકારનું નામ અથવા દિવાની કોર્ટના કુકમનામાં અથવા આદેશના સંબંધમાં વાદીનું નામ	સંદેશની તારીખ નોંધાવેલી તારીખ
માલિકી ફેરખાત/વેચાલ	મોજુ જેતલપુર રે.સ.નં. 104 પાઈ પી.સી. સ.નં. 10657 અને 10653 પી.સી. સુબાલેટ નં. ધીમ અને ધીમ પી.સી. સોભા અને ઓફીસ પ્રીમાઈસીસ નં. 401 વી.આપ બેરીયા 122.00 ચો.મી. 22 ચ 181.00 ચો.મી. વરાડે પડતી વજવડી અથવા જમીન 75.00 ચો.મી.	રાશીકૃત રસિકલાઈ પટેલ સંતીષલાઈ રસિકલાઈ પટેલ મે. શીવ બેસોશીએટસ્ના ભાગીદાર શાશીકૃતલાઈ રસિકલાઈ પટેલ	કેમ્પેલ્સ એન્ડ નોનિયરીસ લી. તરફ કે નફકામાર	૨૦/૦૭/૨૦૦૬ ૨૦/૦૭/૨૦૦૬
રો. 1824870-00				



પ્રકાશલ કરનાર

બસી નકલ

સબ રજીસ્ટ્રાર
એસ આર સી - Akola

રો. માન્ય ગણાશે નહીં.

રો. કોમ્પ્યુટર પિન્ટમાં કોઈ ન

રો. માન્ય ગણાશે નહીં.

ગીતપ રેસીત નો તારીખ : ૨૦/૦૭/૨૦૧૫
અરજી નંબર : ૨૩૯૭
પરિચા નંબર : ૨૦૧૫૦૧૫૦૦૫૦૬૬
તારીખ : ૨૦/૦૭/૨૦૧૫

[illegible]

MGVCL

મધ્ય ગુજરાત વીજ કંપની લીમીટેડ

૨૪. ઓફિસ સરદાર પટેલ વિદ્યુત ભવન, રેસકોર્પ, વડોદરા-૩૯૦૦૦૭

e-mail : info.mgvcl@gujratncl.com, Web Site: www.mgvcl.com, CIN: U40102GJ20035GCO42907, GST NO:24AADCM7439H1ZE

(વીજ વપરાશ બીલ)

હેલ્પ લાઈન નંબર:

CHEMTROLS ENGG LTD
401 GLACIERS COMP
OPP ANUPAMNAKA JETELPUR
VILLAGE-VADODARA (M CORP+OG)
TALUKA-VADODARA
DISTRICT-VADODARA

સંબંધિત વીજળી નામ: BRD ALKAPURI
ચાકક મોબાઈલ: 98XX80XX28
ચાકક હા મેઈલ:
બીલનો માસ: APR.-MAY,24
બુક અને સુટ કોડ: 4/05/20/155
બીલ ની તારીખ:
બીલ ભરવાની છેલ્લી તારીખ:

18002332670



કોડ કોડનામ 005 / JETALPUR

કોડનામ કોડ JTLAN1

ચાકક નંબર: 15105019342

મીટર નંબર: A1-MGS-346052

બીલ નંબર: 2206

ટેરીફ: NRGP

કેઝ	ગુણક	મીટર સ્ટેટસ	મહત્તમ વીજભાર	લોક ઇડિકેટર
1	1			0

કેડબલ્યુ એચ રીએક્ટિવ / ઓફ પીક રાત્રી

કેડબલ્યુ એચ 7951

પાછળું રીડીંગ 7174

વપરાશ 792

સોલર મીટર ઇમ્પોર્ટ એક્સપોર્ટ રીફંડબલ / ચાર્જબલ

કેડબલ્યુ એચ 0

પાછળું રીડીંગ 0

તફાવત

કુલ મહત્તમ વીજભાર ઓફ પીક મહત્તમ વીજભાર રાત્રી મહત્તમ વીજભાર

કેડબલ્યુ એચ 0/0

ટ્યુબ લાઇટ 0/0

પંખા 0/0

કુલ 0.00

કુલ વપરાશ 221

સરેરાશ વપરાશ 180

પાછલો કુલ વપરાશ 221

એડવાન્સ પેમેન્ટ 0.00

એડવાન્સનું વ્યાજ 0.00

કુલ કંપની ચાર્જ 4527.50

સરેરાશ વીજભાર 0.00

પ્રોવીઝનલ બીલની રકમ 0.00

ભરવાપાત્ર સીક્યો. ડીપોઝીટ 0.00

એડવાન્સ વ્યાજની તારીખ

પાછલાં ત્રણ બીલની વિગત

માસ	NOV	JAN	MAR
વપરાશ	275	30	221
બીલની રકમ	6096	3732	5433

નોટિસ: વીજ અધિનિયમ ૨૦૦૩ની કલમ ૫૬(૧) તથા તેને અનુસરતા ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ નિયમો મુજબ આથી આપને નોટિસ આપવામાં આવે છે કે, આપના પાસેથી લેણી પડતી વીજબીલની કુલ રકમ (ખાના નં. ૧૯ મુજબ) આ બીલ કમ નોટિસની બીલ ભરવાની છેલ્લી તારીખથી દિવસ પંદરમાં ભરપાઈ ન થાય તો ત્યાર બાદ આપને અપાતી વીજ પુરવઠો બંધ કરવામાં આવશે. આ બીલમાં અગાઉની રકમ લેણી પડતી હશે તો અગાઉનાં લાગુ પડતાં બીલમાં અપાયેલ નોટિસ મુજબ વીજ પુરવઠો બંધ કરવામાં આવશે. વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે આયોગ દ્વારા નિયત કરેલ પુનઃજોડાણ ચાર્જ સહિત તમામ લેણી નીકળતી રકમ ત્યાં બીલની રકમ સહિત) એક સાથે ભરેલી વિદ્યુત પુરવઠો પુનઃચાલુ કરવામાં આવશે.

મુખ્ય ઇજનેર (મ.ગુ.વી.ક.લિ)

Electricity Bill is a Statement of Charges for the

energy consumed during the billing period and total

amount payable by the consumer and shall not be

considered as a proof of ownership of property.

કાર્યાલય વપરાશ માટે

રકમ ભરવાની તારીખ કેશ ચેક / ડી.ડી. નંબર

ચાકક નંબર 15105019342

માસ MAY-2024

રસીદ નંબર સહી

ડીનોમીનેશન ચાકક નંબર

15105019342

MGVCL

BRD ALKAPURI
Consumer No:15105019342
CHEMTROLS ENGG LTD
401 402 GLACIERS COMP
OPP ANUPAMNAKA JETELPUR

BILL NO:4/2206 Tariff:NRGP
Period :APR-MAY,24 Average:180
Mtr No :1-MGS-346052 SD :21340
Route :4/5/20/155 Load :21.00

Billing Date : 02/06/2024
Current Reading : 7951
Previous Reading : 00007174
Reading Differenc : 777
Reactive Cur Reading: 0
Reactive Prv Reading: 0
Reactive Consumption: 0
Meter Status :
Actual Demand : 0.00
MF : 1.00
Adjustment Amount : -1451.08
Prov. Bill Amount : 0.0

Fixed Charge : 2870.00
Energy Charge : 3613.05
UJALA Charge : 0.00
Fuel Charge : 2214.45
Reactive Charge : 0.00
Electric Duty : 1739.50
Meter Rent : 0.00
DPC : 41.06
Fuse Mis.Charge : 0.00
Total Amount : 10478.06
Prov. Amount : 0.00
Bill Amount : 10478.06
Arrears Date : 24/05/2024
Arrears : -1451.08

Net Amount : 9026.98
GOVT RELIEF : 0.00
Payable Amount : 9026.98
Due Date : 12/06/2024

Ver 4.0 MtrRd:JVR10621
02/06/2024 17:49:21



Scan QR Code for Online Payment

MGVCL

રકમ ભરવાની તારીખ	કેશ	ચેક / ડી.ડી. નંબર
ચાકક નંબર	માસ	રસીદ નંબર
15105019342	MAY-2024	

સહી	ડીનોમીનેશન	ચાકક નંબર
		15105019342